



ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ

નાનાસુલિંગ પ્રયોગિકો (બેલામ અંગરો)
(નાનાસુલિંગ પ્રયોગિકો (બેલામ અંગરો))

સમર યોગ કુંપ

7 થી 15 વર્ષના બાળકો માટે
યોગ અને સંસ્કાર શિબિર

20 થી 29 મે, 2024



યોગાસન માહિતી પુસ્તિકા

સ્વસ્થ અને સક્રિય
જીવનત્તી ચાવી,
યોગથી બાળક બને
ચશ્માંસી અને મેધાવી



समर योग कॅम्प

7 थी 15 वर्षना बालको माटे
योग अने संस्कार शिखिर

20 थी 29 मे, 2024

समर योग कॅम्पना फायदा

- » अनुभवी अने सर्टिफाईड योग शिक्षको द्वारा 10 दिवसनी तालीम
- » कॅम्पना अंते सरकार मान्य सर्टिफिकेट
- » कॅम्प बाट घरे नियमित योग करी शको तेवी माहिती पुस्तिका

योगाथी बालकोने लाभ

- » तन अने मन तंदुरस्त करे
- » भाषातरमां अेकाग्रता सहित यादशक्तिमां वधारो करे
- » बालकने मेधावी अने तेजस्वी बनावे
- » मांसपेशीओनी क्षमता अने शरीरना लचीलापणामां वृद्धि करे
- » तन-मननी तंदुरस्ती केळवी भोबाईल अने जंक्फूड जेवी कुटेवोथी दूर रहेवा प्रेरित कराय



અનુક્રમણિકા

1. શલોક

08 શ્રીમદ્ ભગવદ્ ગીતાના
શલોક

2. મંત્ર

16 સંગઠન મંત્ર
16 ગાયત્રી મંત્ર
17 મહામૃત્યુજ્ય મંત્ર
17 કલ્યાણ મંત્ર

5. આસન

A. ઉંચાઈ
વધારતા આસનો

47	તાડાસન
50	પશ્ચિમોત્તાનાસન
52	ચકાસન
54	હલાસન
56	ભુજંગાસન
58	સર્વાંગાસન

B. પાચનશક્તિ વધારતા
આસનો

62	વજાસન
64	મંડુકાસન
66	ઉત્તાનપાદાસન
68	બાલમુંદિસન
70	પવનમુક્તાસન

C. ચાદશક્તિ / એકાચત્રા
વધારતા આસનો

74	ધ્રુવાસન
76	વૃક્ષાસન
78	ત્રિકોણાસન
82	ગ્રંડાસન
84	પાદહસ્તાસન
88	શશાંકાસન
90	મત્સ્યાસન (ફિશ પોઝ)
92	પદાસન

3. સૂક્ષ્મ / સ્થૂળ વ્યાયામ

- 18** સૂક્ષ્મ વ્યાયામ
 A. આંખની સૂક્ષ્મકિયા
 B. ગરદનની સૂક્ષ્મકિયા
 C. ખભાની સૂક્ષ્મકિયા (ભુજવલ્લી)
 D. કમરની સૂક્ષ્મકિયા (કટિ શક્તિ વિકાસ)
 E. ધૂટાણની સૂક્ષ્મકિયા (પિંડલી)
 F. એન્જિન દોડ

4. સૂર્યનમસ્કાર

32 સૂર્યનમસ્કાર

6. મુદ્રા

- 96 શાંભવી મુદ્રા
98 જ્ઞાન મુદ્રા
100 વિપરીત કરણી મુદ્રા

8. ત્રાટક

- 114 ત્રાટક

9. ધ્યાન

- 116 ધ્યાન

7. પ્રાણાયામ

ચાદશક્તિ / રોગપ્રતિકારક શક્તિ
વધારવા માટેના પ્રાણાયામ

- 104 ભસ્ત્રિકા
106 ક્ર્યાલભાતિ
108 અનુલોમ વિલોમ
110 બ્રામ્શી
112 શીતલી
113 ઉદ્ગીત

10. આદર્શ બાળક

- 120 આદર્શ બાળકની દિનચર્યા
121 આદર્શ બાળકનો આહાર
122 આદર્શ બાળકના સંસ્કાર
123 મોબાઇલની આડઅસરો



01

શ્લોક





ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ

ગુજરાત, ભારત કે

અનુકૂળાંગ્રાહી યોગ અન્દરોળી





શ્રીમદ્ ભગવદ્ ગીતાના શલોક

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतूभूमा ते सङ्गोऽस्त्वकर्मणि॥ 2/47

તारो कर्म करवामां જ અधિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં, માટે તું કર્માના ફળનો હેતુ થા મા, અર્થાત् ફળની અપેક્ષાથી રહિત થઈને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ.

तेरा कर्म करने में ही अधिकार है, उनके फलों में कभी नहीं।
इसलिए तू कर्मों के फल का हेतु मत हो तथा तेरी कर्म न करने में भी आसक्ति न हो।

Your right is to work only, but never to the fruit thereof.
Be not instrumental in making your actions bear fruit, nor let your attachment be to inaction.



योगस्थः कुरु कर्मणि सङ्गं त्यक्तवा धनंजय।
सिद्ध्यसिद्धयोः समो भूत्या समत्वं योग उच्यते॥ 2/48

હે અર્જુન! યોગમાં સ્થિર રહે. આસક્તિ છોડી, સફળતા કે નિષ્ફળતામાં સમાન ભાવ રાખી તું તારાં કર્મ કર. મનનો આવો સમ-ભાવ એ જ યોગ કહેવાય છે.

हे ધનંજય! તू આસક્તિ કો ત્યાગ કર તથા સિદ્ધિ ઔર અસિદ્ધિ મें સમાન બુદ્ધિવાળા હોકર યોગ મें સ્થિત હુआ કર્તવ્યકર્મો કો કર, સમત્વભાવ હી યોગ કહલાતા હૈ।

Arjuna, perform your duties established in Yoga, renouncing attachment, and even-tempered in success and failure; evenness of temper is called Yoga.

क्रोधाद्वयति संमोहः संमोहात्सृतिविभ्रमः।
सृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥ 2/63

क्रोधथी धारणी मूढता आवे छे, मूढताथी स्मृतिमां भ्रम उल्लो थाय छे, स्मृतिमां भ्रम उल्लो थवाथी बुद्धि अर्थात् ज्ञानशक्तिनो नाश थई जाय छे अने बुद्धिनो नाश थवाथी ए पुरुषनुं पोतानी स्थितिथी पतन थाय छे.

क्रोध से अत्यन्त मूढभाव उत्पन्न होता है, मूढभाव से स्मृति में भ्रम होता है, स्मृति में भ्रम हो जाने से बुद्धि अर्थात् ज्ञानशक्ति का नाश होता है, और बुद्धि का नाश हो जाने से यह पुरुष अपनी स्थिति से पतन होता है।

From anger arises loss of judgment; which confuses memory; confused memory causes loss of reason; and from loss of reason one goes to complete ruin.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥ 4/7

हे भारत! ज्यारे अने ज्यां धर्मनुं आचरण मंद पडे छे अने अधर्मनी शक्ति वधे छे त्यारे हुं अवतरे छुं.

हे भारत! जब-जब धर्म की हानि और अधर्म की वृद्धि होती है, तब-तब ही मैं अपने रूप को रचता हूँ अर्थात् साकार रूप से लोगों के सम्मुख प्रकट होता हूँ।

Arjuna, whenever righteousness is on the decline, and unrighteousness is on the rise, at that time, I manifest myself.

**परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे॥ 4/8**

पवित्र जनोनी रक्षा अर्थे अने दुष्टोना नाश माटे तथा धर्मना
सिद्धांतोने इरी स्थापवा काजे हुं युगे युगे प्रगट थाउं छुं.

साधु पुरुषों का उद्धार करने के लिए, पाप कर्म करने वालों का
विनाश करने के लिए और धर्म की अच्छी तरह से स्थापना करने
के लिए मैं युग-युग में प्रकट होता हूं।

To protect the righteous, to annihilate the wicked,
and to reestablish the principles of dharma I
appear on this earth, age after age.



**श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति॥ 4/39**

जे श्रद्धावान् छे, अध्यात्मज्ञाननी लगनीवाणो छे अने जितेन्द्रिय छे ते
पुरुष ज्ञान पामे छे अने तरत ज परम शान्ति भेणवे छे.

जितेन्द्रिय, साधनपरायण और श्रद्धावान् मनुष्य ज्ञान को प्राप्त होता
है तथा ज्ञान को प्राप्त होकर वह बिना विलंब के, तत्काल ही
भगवत्प्राप्तिरूप परम शान्ति को प्राप्त होता है।

**He who has mastered his senses, is exclusively
devoted to his practice and is full of faith, attains
Knowledge; having had the revelation to Truth, he
immediately attains supreme peace (in the form of
God-Realization).**

**योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते॥ 5/7**

जे भक्तिपूर्वक कर्म करे छे, जेनुं अंतःकरण शुद्ध छे, जेणे मन अने इन्द्रियो वश कर्या छे, ते सौने प्रिय छे अने सौने वहालां छे. आवा मनुष्य हमेशा कर्म करतो रहे छतां कर्मबंधनमां इसातो नथी.

जिसका मन अपने वश में है, जो जितेन्द्रिय और विशुद्ध अन्तःकरण वाला तथा सम्पूर्ण प्राणियों का आत्मरूप परमात्म ही जिसका आत्मा है, ऐसा कर्मयोगी कर्म करता हुआ भी लिप्त नहीं होता।

The Karamayogi, who has fully conquered his mind and mastered his senses, whose heart is pure, and who has identified himself with the self of all beings (viz, God), remains untainted, even though performing action.



**युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्रावबोधस्य योगो भवति दुःखहा॥ 6/17**

अर्थात् दुःखोनो नाश करनार योग तो यथायोग्य आहार-विहार करनारनो, कर्मोमां यथायोग्य चेष्टा करनारनो तथा यथायोग्य उंधनार तेमज्ज जागनारनो ज सिद्ध थाय छे.

दुःखों का नाश करने वाला योग तो यथायोग्य आहार-विहार करने वाले का, कर्मो में यथा योग्य चेष्टा करने वाले का और यथायोग्य सोने तथा जागने वाले का ही सिद्ध होता है।

**Yoga, which rids one of woe, is accomplished only
by him who is regulated in diet and recreation,
regulated in performing actions, and regulated in
sleep and wakefulness.**

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्णते॥ 6/35

હે મહાબાહો! નિઃસંદેહ મન ચંચળ, તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં
પણ હે કોંતેચ! સતત અભ્યાસ અને વૈરાગ્યથી તને વશ કરી શકાય.

હે મહાબાહો! નિઃસંદેહ મન ચંચલ ઔર કઠિનતા સે વશ મેં હોને વાલા હૈ
પરંતુ હે કુન્તીપુત્ર અર્જુન! યહ અભ્યાસ ઔર વૈરાગ્ય સે વશ મેં હોતા હૈ।

The mind is restless no doubt; and difficult to curb,
Arjuna; but it can be brought under control by
repeated practice (of meditation) and by the exercise
of dispassion, O' son of Kunti.

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥ 18/66

બીજા બધા ધર્મોને છોડીને માત્ર મારે જ શરારો આવ, હું તને બધાં
પાપોથી મુક્ત કરીશ. તું ડરીશ નહીં.

સभી પ્રકાર કે ધર્મો કા પરિત્યાગ કરો ઔર કેવલ મેરી શરણ
ગ્રહણ કરો। મૈં તુમ્હેં સમસ્ત પાપ કર્મો કી પ્રતિક્રિયાઓં સે મુક્ત
કર દૂંગા, ડરો મત।

Abandon all varieties of dharmas and simply
surrender unto Me alone. I shall liberate you
from all sinful reactions; do not fear.

02

ਮੁੰਕ



ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ
સ્થાપના ત્રણા વિનાને
સાંકુદ્રાંકનાના વિનાના કોર્ટો



સંગઠન મંત્ર

ॐ સંગચ્છદ્વં સંવદદ્વં સં વો મનાંસિ જાનતામ्।
દેવા ભાગં યથા પૂર્વે સર્જાનાના ઉપાસતે॥

આપણે એક સાથે ચાલીએ, એક સાથે બોલીએ, આપણું મન એક બને. પ્રાચીન સમયના દેવતાઓનું આવું આચરણ હતું એટલે તેઓ વંદનીય છે.

હમ સબ એક સાથ ચલેં; એક સાથ બોલેં; હમારે મન એક હોંને. પ્રાચીન સમય મેં દેવતાઓં કા ઐસા આચરણ રહા ઇસી કારણ વે વંદનીય હોય.

Let us all go together; speak together; May our minds be united. This was the behavior of the gods in ancient times, that is why they are venerable.

ગાયત્રી મંત્ર

ॐ મૂર્ખવ: સ્વ: તત્સવિતુવરીણં ભર્ગો।
દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત्॥

એ પ્રાણસ્વરૂપ, દુઃખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ પ્રેરિત કરે.

ઉસ પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્મા કો હમ અપની અન્તરાત્મા મેં ધારણ કરેં. વહ પરમાત્મા હમારી બુદ્ધિ કો સન્માર્ગ મેં પ્રેરિત કરે।

"Oh God! You are the Giver of Life, the Remover of Pain and Sorrow, the Bestower of happiness, the most excellent, majestic. Oh! Creator of the Universe, may we receive your supreme sin-destroying light. May you guide our intellect in the right direction.

મહામृત્યુજ્ય મંત્ર

ॐ ત্রયાંબકं યजામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ् ।
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય માઽમૃતાત् ॥

અમે ત્રિનેત્રધારી ભગવાન શિવની પૂજા કરીએ છીએ, તેઓ સુગંધિત છે અને સૌનું પોષણ કરે છે. જેવી રીતે સંપૂર્ણ પરિપક્વ થયેલા ચીભડાનાં ફળ આપોઆપ તેના વેલા પરથી ખરી પડે છે તે રીતે મને તમે અમૃતમય આત્માથી અમરત્વ પ્રાપ્ત થાય તે માટે મૃત્યુના બંધનથી મુક્તિ પ્રદાન કરો.

હમ ત્રિનેત્ર કો પૂજતે હું, જો સુગંધિત હું, હમારા પોષણ કરતે હું, જિસ તરહ ફળ, શાર્ખા કે બંધન સે મુક્ત હો જાતા હૈ, વૈસે હી હમ મી મૃત્યુ ઔર નશ્શરતા સે મુક્ત હો જાએં।

We pray to Tryambaka the fragrant, the nourisher of all. Like the fruit that falls off from the bondage of the stem, may we be liberated from death, from mortality.

કલ્યાણ મંત્ર

ॐ સર્વેમબવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ ।
સર્વેમદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખ ભાગ્મવેત् ॥

સૌ સુખી થાઓ, સૌ રોગ મુક્ત રહો, સૌ મંગલમય ઘટનાઓના સાક્ષી બનો અને કોઈને પણ દુઃખના ભાગીદાર ન બનવું પડે.

સમી સુખી હોવેં, સમી રોગમુક્ત રહેં, સમી મંગલમય ઘટનાઓં કે સાક્ષી બનેં ઔર કિસી કો મી દુઃખ કા ભાગી ન બનના પડે। ॐ શાંતિ શાંતિ શાંતિ।

May all sentient beings be happy, may no one suffer from illness,
May all see what is auspicious, may no one suffer. Om peace,
peace, peace.

03

સૂક્ષ્મ / સ્થળ
વ્યાયામ





ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ

ગુજરાત, ગુજરાત

સાનુદિપ પટેલના માના વાણી





સૂક્ષ્મ / સ્થૂળ વ્યાયામ

ફાયદા

સૂક્ષ્મકિયા રક્તસંચાર વધારવામાં
ઉપયોગી બને છે. સૂક્ષ્મકિયા ઊભા રહીને
અથવા બેસીને પાણી કરી શકાય છે.



આંખની સૂક્ષ્મકિયા



આંખની કીકી ઉપર તરફ અને નીચે તરફ કરો.



આંખની કીકી જમણી અને ડાબી તરફ કરો.





આંખની કીકીને ઘડિયાળના કાંટાની દિશા તરફથી પરિભ્રમણ કરાવો.



આંખની કીકીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તરફ પરિભ્રમણ કરાવો.

ફાયદા

આંખોના તેજમાં વધારો થાય છે.

આંખોની નબળાઈ દૂર થાય.

ચસમાંના નંબર દૂર થાય.

ગરદનની સૂક્ષ્મકિયા



સ્થિતિ - 1

સ્થિતિ - 2

આગળ અને પાછળ નમાવવં

- » બંને હાથ કમર ઉપર રાખો. રેચક કરતાં, માથું આગળની તરફ ધીરે-ધીરે જૂકાવો, દાઢીને છાતી તરફ લગાવવાનો પ્રયત્ન કરો.
- » પૂરક કરતાં, માથું પાછળની તરફ સહજતાપૂર્વક જેટલું જાય તેટલું લઈ જાવ.
- » આ એક રાઉન્ડ થયો, હજુ બે રાઉન્ડ કરો.

જમણી અને ડાબી બાજુ વાળવં


- » પ્રારંભિક સ્થિતિમાં માથું સીધું (ટવ્વાર) રાખો.
- » રેચક કરતાં, ધીરેથી માથું જમણી બાજુ ઓટલું લઈ જાઓ કે તમારી દાઢી ખભાને સમાંતર થઈ જાય.
- » પૂરક કરતાં, માથું સામાન્ય સ્થિતિમાં લાવો.
- » આ જ રીતે રેચક કરતાં, માથું ડાબી બાજુ લઈ જાવ.
- » પૂરક કરતાં, માથું સામાન્ય સ્થિતિમાં લાવો.
- » આ એક રાઉન્ડ થયો, હજુ બે રાઉન્ડ કરો.



સ્થિતિ - 3

જમણી અને ડાબી બાજુ નમાવવું

- » રેચક કરતાં, માથું જમણી બાજુ ધીરે-ધીરે નમાવી કરને ખભા સાથે સ્પર્શ કરો, ચાદ રહે કે ખભા ઊઠવા ન જોઈએ.
- » પૂરક કરતાં, માથું સામાન્ય સ્થિતિમાં લાવો.
- » રેચક કરતાં, માથું ડાબી બાજુ ધીરે-ધીરે નમાવવું.
- » પૂરક કરતાં, માથું સામાન્ય સ્થિતિમાં લાવો.
- » આ એક રાઉન્ડ થયો, હજુ બે રાઉન્ડ કરો.



સ્થિતિ - 4

કલોક અને અંનિ કલોકવાઈઝ

- » રેચક કરતાં, માથું આગળ તરફ ઝૂકાવો કે દાઢી છાતીને અડકી જાય.
- » પૂરક કરતાં, ધીરેથી માથું ઘડિયાળના કાંટાની દિશામાં ડાબી તરફથી જમણી તરફ (કલોકવાઈઝ) ઘુમાવો. નીચે આવો ત્યારે રેચક કરો.
- » માથું આખું ગોળ ઘુમાવવું.
- » ત્યારબાદ, આવી જ રીતે માથું વિરુદ્ધ દિશામાં એટલે કે જમણી તરફથી ડાબી તરફ (અંનિ કલોકવાઈઝ) ઘુમાવો.
- » ધ્યાન રહે, પૂરક કરતાં પાછળ અને રેચક કરતાં નીચે આવવાનું છે.
- » આ એક રાઉન્ડ થયો, હજુ બે રાઉન્ડ કરો.

સૂચના

- » માથું જેટલું વાળી શકો તેટલું જ વાળો, વધુ શ્રમ ન આપો.
- » ગરદન ફરતે તાણાવ અને સાંધા તથા સનાયુઓને શિથિલ થતાં અનુભવો.
- » આ અભ્યાસ ખુરશીમાં બેસીને પણ કરી શકાય છે.
- » જે બાળકને ગરદનમાં દુખાવો હોય તેમને ધ્યાનથી અભ્યાસ કરવો, ખાસ કરીને માથું જ્યારે પાછળ જાય.

ખભાની સૂક્ષ્મકિયા (ભુજવલ્લી)



શ્વાસ ભરતા બંને હાથના પંજા કોણીમાંથી વાળી ખભા પર મૂકો અને શ્વાસ
છોડતાં ખભાની બહારની બાજુ તરફ ફેલાવો. (5 વખત)



બંને હાથને કોણીમાંથી વાળી હાથના પંજા ખભા પર મૂકી, કોણીને ઉપરથી નીચે
ઉઠવતા ખભાનું પરિભ્રમણ કરો. (5 વખત કલોકવાઈએ અને ઓન્ટિ કલોકવાઈએ)
કોણી આંગળીઓને સમાંતર સામે આવે ત્યારે જોડવાનો પ્રયત્ન કરો.


કમરની સૂક્ષ્મકિયા (કટિ શક્તિ વિકાસ)

સ્થિતિ

- » સમાસ્થિતિમાં ઉભા રહો.
- » બંને હાથને ખલાની સમાંતર ફેલાવો.
- » હથેળી જમીન તરફ રાખો, આંગળીઓ સાથે રાખો શાસ ભરતા ડાબી તરફ 30° ના કોણ પર ઝૂકો.
- » જમણા હાથને 150° ઉપર લઈ જઈ બંને હાથને એક રેખામાં લાવો.
- » હાથની સાથે ગરદન અને કમરને પણ ઝૂકાવો.
- » શાસ છોડતા પૂર્વવત્ત સ્થિતિમાં આવો.
- » ફરી શાસ લેતા બીજુ તરફ આ સ્થિતિ કરો.
- » આ કિયાનું 10 વખત પુનરાવર્તન કરો.



ધૂંટણાની સૂક્ષ્મકિયા (પિંડલી)



સ્થિતિ

- » સમસ્થિતિમાં ઉભા રહો.
- » બંને હાથોને જમીનની તરફ ખોલેલા ખમાથી સમાંતર ફેલાવો.
- » શાસ છોડતા ધૂંટણ મેળવતા બેઠક લગાવો.
- » એડીને જમીન સાથે જોડાયેલી રાખો.
- » શાસ ભરી ઉભા થતા પહેલા બંને હાથોને ખત્તમાં સમાંતર ફેલાવો.
- » ત્યારબાદ હાથને નીચે લાવી પૂર્વવત્ત સ્થિતમાં આવો.
- » આ કિયાનું 5 વાર પુનરાવર્તન કરો.

એન્જિન દોડ



સ્થિતિ

- » સમસ્થિતિમાં ઉભા રહો.
- » અંગૂઠા અંદર દબાવી મુહી વાળો અને કોણીને કમરથી જોડાયેલી રાખો.
- » ડાબા હાથને કોણીથી વાળી જમીનને સમાંતર કમર સાથે જોડો.
- » મુહીનો ભાગ એક-બીજાની સામે રાખો.
- » શાસ લઈ ડાબા પગને ધૂટણા સુધી 90° ના કોણ પર ઉઠાવો.
- » જમણા હાથને સામે લાવો અને શાસ છોડો.
- » તુરેત શાસ લઈ જમણા પગને વાળી 90° ના કોણ પર ઉઠાવો અને ડાબો હાથ સામે કરો.
- » શાસ છોડી જમણો હાથ અને ડાબો પગ પૂર્વવત્ત સ્થિતિમાં લાવો.
- » આ સ્થિતિનું બંને તરફ 8-10 વખત પુનરાવર્તન કરો.
- » પોતાના સ્થાન પર ઝડપથી ઢોડો, થાક અનુભવો ત્યારે આ હિયા પૂર્ણ કરો.




04

सूर्यनमस्कार



ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ
(અધ્યાત્મિક, શુદ્ધ જીવન
સંસ્કૃતિક પ્રવાહિની) વિભાગ અધિકારી





સૂર્યનમસ્કાર

સૂર્ય, ધરતી પર ઊર્જા અને પ્રકાશનો મુખ્ય સ્વોત છે. સૂર્યની ઊર્જાથી સમગ્ર જીવન ચેતનવંતુ બને છે. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે પ્રાતઃકાળના ઊગતા સૂર્યના કિરણો આપણા શરીર પર વિશિષ્ટ ચિકિત્સકીય અસર કરે છે. આપણા પૂર્વજોએ વિશેષ શોધ અને સંશોધન દ્વારા જાણ્યું છે કે, પ્રાતઃકાળના સમયમાં તેના જુદા-જુદા પ્રકારથી વિશેષ કુમનો અભ્યાસ કરવાથી આપણાને 24 કલાક ઊર્જાનું સ્તર જાળવી રાખવામાં વિશિષ્ટ મદદ મળે છે. ઋષિ મુનિઓએ 12 સ્થિતિઓના વિશિષ્ટ સંયોજનને 'સૂર્યનમસ્કાર' નામ આપ્યું છે, જે સ્વયં એક સંપૂર્ણ વ્યાયામ છે.

સૂર્યનમસ્કારની 12 સ્થિતિઓને ઓકવાર પૂર્ણ કરવીએ એક આવૃત્તિ (ચક) કહેવાય છે. વિશેષજ્ઞો માને છે કે, આ બાર સ્થિતિના અભ્યાસ દરમિયાન પૂરક, કુભક અને રેચકને ધ્યાનમાં રાખવાથી તેને સવિશેષ લાભ પ્રાપ્ત થાય છે.



સ્થિતિ - 1

સ્થિતિનું નામ: પ્રણામાસન

શાસન: સામાન્ય

એકાગ્રતા કેન્દ્ર: અનાહત ચક્ક

મંત્ર: ઉં મિત્રાય નમ:

અર્થ: હે વિશ્વના મિત્ર! આપને પ્રણામ છે.

» રીત:

- » સૂર્યોદય સમયે સૂર્યાભિમુખ સાવધાનની સ્થિતિમાં ઉભા રહો.
ધ્યાન રાખો કે એડી, પંજા અને ઘૂંટાણ પરસ્પર ગોઠવાયેલા હોય.
- » નમસ્કારની સ્થિતિમાં બંને હાથને છાતીની સામે રાખો. શાસની
ગતિ સામાન્ય રાખો.
- » આ સ્થિતિમાં હાથ અને પગને જોડી ઉભા રહેવાથી ઊર્જાના
પરિપથનું નિર્માણ થાય છે અને શરીર શીଘ્ર ઊર્જાન્વિત થાય છે.



स्थिति - 2

स्थितिनुं नामः उत्तर्तितानासन / उर्ध्वउत्तरासन

श्वासः श्वास भरवो

अकायता केन्द्रः विशुद्धि चक्र

मंत्रः ऊँ रवये नमः

अर्थः हे संसारमां सक्षियता लावनार!
आपने प्राणाम छे.

रीतः

- » बने हाथनी कोणी सीधी राखीने, उपर तरफ खोलीने शरीरने पाछળनी तरफ झूकावो,
माथुं बने हाथनी वर्चे स्थित रहेवुं जोઈओ.
- » श्वास अटकावीने दृष्टि आकाश तरफ राखी
कमरने यथाशक्ति पाछण झूकावो.



स्थिति - 3

स्थितिनुं नामः पादउत्तरासन

श्वासः श्वास छोडवो

अकायता केन्द्रः स्वाधिष्ठान चक्र

मंत्रः ऊँ सूर्योदय नमः

अर्थः हे संसारना ज्ञवनदाता! आपने प्राणाम छे.

रीतः

- » स्थिति-2 पछी श्वास बहार काढीने हाथने
पाछળथी सामेनी बाजु लावता वांकावणी
बने पग पासे जमीन पर टेकवो.
- » जो शक्य होय तो हथेलीओने पाण
पंजानी डाबी अने जमाणी तरफ भूमि पर
स्पर्श करावो अने माथुं बने घूटाणने स्पर्श
करे तेवो प्रयास करो. ध्यान राखो के
घूटाण वरो नहीं.



स्थिति - 4

स्थितिनुं नामः अश्वसंचालन

श्वासः श्वास भरवो

अेकाग्रता केन्द्रः आङ्गो चक्र

मंत्रः ऊँ भानवे नमः

अर्थः हे प्रकाशपुंज! आपने प्रणाम छे.

रीतः

» स्थिति-३ पछी हवे नीचेनी तरफ बलता बने हाथनी हथेणीओ जमीन पर टेकवो, डाढो पग उपाडीने पाइणनी तरफ लट्ठ पंजा पर राखी सीधो खेंचीने राखो, जमाणो पग बने हाथनी वच्ये रहे (पगनी एडी जमीन पर स्पर्श करती होवी जोईओ) घूंटाण छातीनी सामे रहे अने दृष्टि आकाश तरफ, श्वास अंदरनी तरफ भरी राखो.



स्थिति - 5

स्थितिनुं नामः पर्वतासान

श्वासः श्वास छोडवो

अेकाग्रता केन्द्रः विशुद्धि चक्र

मंत्रः ऊँ खगाय नमः

अर्थः हे आकाशमां गतिशील देव! आपने प्रणाम छे.

रीतः

» श्वास बहार काढीने जमाणा पगने पण पाइण लट्ठ जाओ.

» गरदन अने माथुं बने हाथनी वच्ये रहे ते रीते, कमरने उपरनी तरफ पर्वतनी जेम उठावो अने माथाने नमावीने नालि तरफ जोवानो प्रयत्न करो.

સૂર્યનમસ્કાર



સ્થિતિ - 6

સ્થિતિનું નામ: અષ્ટાંગનમનાસન

શાસ: સામાન્ય શાસ

ઓકાશતા કેન્દ્ર: મહિપુર ચક

મંત્ર: ઊં પૂષ્ટાં નમ:

અર્થ: હે સંસારના પોષક! આપને પ્રાણામ છે.

રીત:

- » હાથ અને પગના પંજાને સ્થિર રાખતા છાતી અને ધૂંટણાને ભૂમિ પર સ્પર્શ કરો. નાભિ ભાગ ઉઠેલો રાખો.
- » આ પ્રકારે બંને હાથ, બંને પગ, ધૂંટણ, છાતી અને દાઢી જમીન પર સ્પર્શ કરો.
- » આ આહેય અંગોને જમીનપર ટેકવીને તે અષ્ટાંગનમન આસન બને છે. શાસોશાસ સામાન્ય રહેશો.



સ્થિતિ - 7

સ્થિતિનું નામ: ભુજંગાસન

શાસ: શાસ ભરવો

ઓકાશતા કેન્દ્ર: સ્વાધિષ્ઠાન ચક

મંત્ર: ઊં હિરાયગર્ભાય નમ:

અર્થ: હે જ્યોતિર્મય! આનંદમય! આપને પ્રાણામ છે.

રીત:

- » શાસ અંદરભરીને (ભુજંગાસનની આકૃતિ) છાતીને ઉપર ઉઠાવતા હથને ધીરે- ધીરે સીધા કરો, પાછળથી બંને પગ પાસે લાવો અને ખેંચાયેલા રાખો, પગના તળીયા આકાશ તરફ રાખો. નાભી સુધીના ભાગને જમીન પર ટેકવેલા રાખો અને દૃષ્ટિ આકાશ તરફ રાખો.



स्थिति - 8

स्थितिनुं नामः पर्वतासन

श्वासः श्वास छोडવो

ऐकाग्रता केन्द्रः विशुद्धि चक्र

मंत्रः ऊँ मरियचे नमः

अर्थः हे संसारना प्रकाशक स्वामी!
आपने प्राणाम छे.

रीतः

» गरदन अने माथुं बने हाथनी वच्ये रहे ते
रीते, नितंब अने कमरने उपरनी तरफ
पर्वतनी जेम उठावो अने माथाने
नमावीने नाभि तरफ जोवानो प्रयास करो.



स्थिति - 9

स्थितिनुं नामः अश्वसंचालनासन

श्वासः श्वास भरवो

ऐकाग्रता केन्द्रः आङ्गा चक्र

मंत्रः ऊँ आहित्याय नमः

अर्थः हे संसारना रक्षक! आपने प्राणाम छे.

रीतः

» डाबो पग गोठाश्थी वाणी आगण बंने
हाथना पंजानी वच्ये एडी जमीन पर स्पर्श
थाय ते रीते स्थिर करो अने पाछળ रहेला
जमाणा पगनो गोठाश जमीनने स्पर्श थाय
तेम पाछળ जेंयेली स्थितिमां राखो. गरदन
आगण उपरनी तरफ, दृष्टि आकाश तरफ,
श्वास अंदर भरेलो राखवो.

सूर्यनमस्कार



स्थिति - 10

स्थितिनुं नामः पादहस्तासन

श्वासः श्वास छोडवो

ऐकाग्रता केन्द्रः स्वाधिष्ठान चक्र

मंत्रः ओं सावित्रे नमः

अर्थः हे सृष्टिकर्ता! आपने प्रशाम छे.

रीतः

- » श्वास बहार काढीने हाथने सामे नमावता पग पासे जमीन पर टेकवो.
- » जो शक्य होय तो हथेजीओने पण पंजानी डाबी अने जमाणी तरफ भूमि पर स्पर्श करो अने माथुं बने धूटणने स्पर्श करे तेवो प्रथल करो.
- » ध्यान राखो के धूटण वળे नहीं.



स्थिति - 11

स्थितिनुं नामः उस्तउत्तानासन/उर्ध्वहस्तासन

श्वासः श्वास भरवो

ऐकाग्रता केन्द्रः विशुद्धि चक्र

मंत्रः ओं अर्काय नमः

अर्थः हे पवित्रताना शोधक! आपने प्रशाम छे.

रीतः

- » बने हाथनी कोणी सीधी राखीने, खुल्ली करीने शरीरने पाइणनी तरफ झूकावो, माथुं बने हाथनी वच्ये स्थित रहेवुं जोઈए.
- » श्वास अटकावीने दृष्टि आकाश तरफ राखी कमरने यथाशक्ति पाइण झूकावो.



સૂર્યનમસ્કારના લાભ

સ્થિતિ - 12

સ્થિતિનું નામ: પ્રણામાસન

શાસ: સામાન્ય

આજ્ઞાચક કેન્દ્ર: અનાહત ચક્ક

મંત્ર: ઓં ભાર્સ્કરાય નમ:

અર્થ: હે જ્ઞાનદાતા! આપને પ્રણામ છે.

રીત:

- » સ્થિતિ-11 માંથી પુનઃસ્થિતિ-1 મુજબ સૂર્યાભિમુખ નમસ્કારની સ્થિતિમાં આવો. ધ્યાન રહે કે એડી, પંજા અને ઘૂંટણ પરસ્પર ગોઠવાયેલા રહે.
- » શ્વાસની ગતિ સામાન્ય રાખો.
- » મનને સ્થિર કરી અને શરીરની અંદર ઊર્જાશક્તિનું સંચાલન થતા સંપૂર્ણ શરીર હલકું બને છે અને સંતોષની લાગણી થતા આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.
- » બંને હાથને છાતીની સામે રાખો.

- » સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ વ્યાયામ છે.
- » નિયમિત અભ્યાસથી શરીરના દરેક અંગ-ઉપાંગ બળવાન અને નિરોગી બને છે.
- » પેટ, આંતરડા, સ્વાદુપિંડ, હદ્ય અને ફેફસાં સ્વસ્થ રહે છે.
- » કરોડરજ્જુ અને કમરને લચીલી બનાવીને તેમાં આવેલી વિકૃતિઓને દૂર કરે છે.
- » આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ધીરે-ધીરે સારી અસર કરવા લાગે છે.
- » સૂર્યના કિરણો ત્વચા પર પડવાથી આપણા શરીરમાં વિટામિન ‘ડી’ નું નિર્માણ થાય છે.
- » આ વિટામિન કંલિશાયમ જેવા અતિઆવશ્યક ખનિજ તત્ત્વોને શરીરમાં શોષી અંત્યત ઉપયોગી બનાવે છે.
- » હાડકાં મજબૂત બનાવે છે.
- » નાના બાળકોની ઉંચાઈમાં વધારો કરે છે.

પ્રાતઃ કાળના સૂર્યના પ્રકાશનો
ભરપૂર ઉપયોગ કરવાથી
તણાવ, થાક, ઉદાસીનતા
નિર્મૂળ થઈ જાય છે. મન,
મસ્તિષ્ક અને શરીરમાં
તાજગી રહે છે.

સૂર્યનમસ્કારની વિવિધ
પ્રક્રિયાઓ દ્વારા આપણા
અધિમુનિઓનો આપણાને
પ્રાકૃતિક નિયમો સાથે સંયોગ
બનાવીને આરોગ્યમય જીવન
જીવવાનો અદ્ભુત સંદેશ છે.



સૂર્યનમસ્કાર





05

આસન





ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ
અમદાવાદ, ગુજરાત
સરકારી પ્રવૃત્તિની ધ્રુવાક્ષર





A. ઉંચાઈ વધારતા આસનો

ઉંચાઈ વધારતા આસનોમાં તાડાસન,
પશ્ચિમોત્તાનાસન, ચક્કાસન, હલાસન,
ભુજંગાસન અને સર્વાંગાસન જેવા વિવિધ
આસનોનો સમાવેશ થાય છે. આ આસનોના
નિયમિત અભ્યાસથી સ્નાયુઓ તંગ થતા
હોવાથી બાળકોની ઉંચાઈમાં વધારો થાય છે.



તાડાસન

'તાડ'નો અર્થ 'તાડનું વૃક્ષ' થાય છે. આ આસન સ્થિતિસ્થાપકતા અને શારીરિક સજ્જતામાં વધારો કરે છે.

ફાયદા

કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવામાં આ આસન ઉપયોગી બને છે.

ખભા, ઘૂંટી અને પગના પંજાઓ મજબૂત બને છે.

ફેફસાંની કાર્યશક્તિ વધે છે.

કરોડની ચેતાઓ સતેજ બને છે.

એકાચ્રતામાં વધારો થાય છે.

સૂચનો

બને તરફથી હાથ ઉપર લઇ જઇ તેને લોક કરીને પણ તાડાસન કરી શકાય છે.



સ્થિતિ - 1

આસન પર ટઢ્હાર ઉભા રહો.



સ્થિતિ - 2

બંને હાથની આંગળીઓને
લોક કરી સામેની તરફ
ખેંચો.



સ્થિતિ - 3

જોડેલી આંગળીઓ સાથે બંને
હાથને કાન પાસેથી અને પૂરક કરી
આંતર કુંભકમાં એડીઓ ઊંચી
કરી પગની આંગળીઓ પર
શરીરને ઉંચું કરો. યથાશક્તિ
ટકાવી રાખો.

તाडासन



स्थिति - 4

रेचक करतां-करतां बंने हाथ
तथा एडीओने नीचे लावी
मूळ स्थितिमां आवो.



स्थिति - 5

आसन पर सामान्य
स्थितिमां उभा रहो



પશ્ચિમોત્તાનાસન

ફાયદા

પાચનતંત્ર સક્રિય થાય છે.

ઠીંગણાપણું દૂર કરે છે.

હાથ, પગ અને બીજા અંગેના સાંધાઓ મજબૂત બને છે.

શરીર કાર્યશીલ બને છે.

રોગો દૂર થાય છે.

શરીર સુડોળ અને ઘાટીલું બને છે.

ઓસિડિટી, વાયુ વિકાર દૂર થાય છે.

સૂચનો

ગોઠણ સીધા જ રહે તેનું ધ્યાન રાખવું.

કરોડરજુની તકલીફ હોય તો આ આસન માર્ગદર્શકની સલાહમાં કરવું હિતાવહ છે.



સ્થિતિ - 1

બંને પગને સનમુખ લાંબા સીધા ફેલાવો.



સ્થિતિ - 2

બંને હાથની આંગળોથી બંને પગની આંગળોને પકડી શરીરને આગળની તરફ ઝૂકાવો.

સ્થિતિ - 3

બંને હાથની કોણોઓને જમીનને સ્પર્શ કરાવો અને માથાને ઘૂંટણ ઉપર મૂકવા પ્રયત્ન કરો.

ચકાસન

આ આસનમાં શરીરની સ્થિતિ ચક જેવી બનતી હોવાથી તેને 'ચકાસન' કહેવામાં આવે છે.

ફાયદા

નિયમિત અભ્યાસથી પેટ અને પેટની માંસપેશીઓ મજબૂત બને છે.

બાવડા, ધૂટણ, સાથળના અવયવને ફાયદો થાય છે.

કરોડરજ્જુ લચીલી બને છે.

બાળકોનું ઠીંગાણાપણું દૂર થાય છે.

સૂચનો

બંને હાથ અને પગ વચ્ચે ચોગ્ય અંતર રાખવું.

હાથ અને પગ પર એકસરખું વજન આવે તેનું ધ્યાન રાખવું.

આસન છોડતી વખતે શરીરને પછાડો નહીં, ધીમે-ધીમે મૂળ સ્થિતિમાં આવવું.

કોઈ પણ સ્થિતિમાં ઉતાવળ કરવી નહીં.



स्थिति - 1

पीठना बળे सीधा सूઈ जाओ.



स्थिति - 2

श्वास छोडो, बने हाथने आकाश तરफ उपर उठावो
अने धीमे-धीमे श्वास भरता कमरने उपर उठावो.



स्थिति - 3

हाथने उपरथी पाइज
वाणीने जमीन उपर राखो
अने तरत ज कोरीओ
उपर बने बावडां सीधा
करी लो अने हथेणीओ
जमीन पर टेकवो.

હલાસન

હલાસન એ સર્વાગાસનનું પૂરક આસન છે. હલાસન સામાન્ય રીતે સર્વાગાસન પછી કરવામાં આવે છે. આ આસનમાં શરીરની સ્થિતિ હળ જેવી થતી હોવાથી આ આસનને 'હલાસન' તરીકે ઓળખવામાં આવે છે.

ફાયદા

કબજિયાત, મંદાશ્રી, અજીર્ણ, આંતરડાની નભળાઈ દૂર થાય છે.

પાચનકિયા તીવ્ર બને છે, બરોળ અને ચકૃત મજબૂત બને છે.

પીઠના સ્નાયુઓ મજબૂત બને છે અને કરોડરજજુના સ્નાયુઓને પોષણ મળે છે.

આ આસનમાં પગ અને હાથ વિપરીત દિશામાં તાણાવમાં આવે છે, જેનાથી કરોડરજજુ પર સંપૂર્ણ તાણાવ પડે છે.

બાળકોની ઊંચાઈમાં વધારો કરે છે.


સ્થિતિ - 1

પીઠના બળો સીધા સૂઈ જાઓ.



સ્થિતિ - 2

માથા ઉપરથી હાથ અને પગને
સરકાવી જમીન ઉપર બંને
પગને એવી રીતે લગાવો કે
પગના અંગૂહા અને આંગળીઓ
જ જમીન પર સ્પર્શ કરે.



સ્થિતિ - 3

ફેફસાંમાં શ્યાસ ભરો, ધૂટણા સહિત પગને એકદમ સીધા રાખો અને
હાથને પગની વિપરીત દિશામાં જમીન પર ફેલાવો.

ભુજ્ઞાસન

ભુજ્ઞાનો અર્થ નાગ અથવા સર્પ થાય છે. આ આસનમાં શરીરની સ્થિતિ ફેણ ઉઠાવેલા નાગ જેવી બનતી હોવાથી તેને 'ભુજ્ઞાસન' કહે છે.

ફાયદા

પેટના અવયવોને માલિશ મળે છે અને એ સ્વસ્થ રહે છે.

ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે.

મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે અને કમર વધુ સ્થિતિસ્થાપક બને છે.

બાળકોનું ઠીંગણાપણું દૂર કરે છે.

સ્મરણાશક્તિમાં વધારો થાય છે.

સ્થિતિ - 1

પેટના બળો જમીન પર સૂઈ જાઓ.



સ્થિતિ - 2

હાથને ખમાની નજીક રાખો અને ધડને હાથના બળો ઉપર ઉઠાવો, આસન દરમિયાન હથેળી પર જોર આપો જેથી શરીર ચોગ્ય રીતે ખેંચાયેલું રહે અને દૃષ્ટિ સામેની તરફ રાખો.



સર્વિંગાસન

સર્વનો અર્થ પૂર્ણ અથવા તમામ થાય છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી તેને 'સર્વિંગાસન' કહે છે.

ફાયદા

આ આસનથી ચાદશક્તિ અને મેધાશક્તિમાં વધારો થાય છે.

ગરદનના માર્ગકામાંથી નીકળતી ઝાનતંતુની નાડીઓને સબળ બનાવે છે.

મુખ પરના ખીલ અને ડાઢા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.

સૂચનો

મેદસ્વી વ્યક્તિએ માર્ગદર્શન હેઠળ આસન કરવું.

સ્થિતિ - 1

પીઠના બળો સીધા સૂઈ જાઓ.





સ્થિતિ - 2

બંને હાથને કમરની આજુ-બાજુ રાખો.



સ્થિતિ - 3

ધૂટાણે મજબૂત રાખીને ધીમે-ધીમે બંને
પગને ઉપરની તરફ એટલા જ ઉઠાવો કે
પગ કમરની સમાંતર થઈ જાય. હવે
તમારી હથેળીઓને કમર પર ટેકવો અને
હાથના સહારે એટલી ઉઠાવો કે દાઢી
તમારી છાતીને સ્પર્શ કરે.



B. પાચનશક્તિ વધારતા આસનો

બાળકોના શરીરમાં સતત નવા કોષોનું નિર્માણ થતું હોય છે. આ અવસ્થામાં ભૂખ વધુ લાગતી હોવાથી પાચનશક્તિ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે, વજાસન, મંડૂકાસન, ઉત્તાનપાદાસન, બાલમુકુંદાસન અને પવનમુક્તાસન જેવા આસનોનો નિયમિત અભ્યાસ બાળકોની પાચનશક્તિને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વજાસન

આ આસનમાં બંને જાંઘોને વજાકાર ગોઠવવામાં આવતી હોવાથી
આ સ્થિતિને 'વજાસન' કહે છે.

ફાયદા

ધૂંટણ અને ઢીચણના સાંધારોની પીડા દૂર થાય છે.

ભોજન પછી તુરેત જ આ આસનમાં બેસવાથી પાચનકિયા
સરસ રીતે થાય છે.

કબજિયાત, અપચો અને ગેંસની તકલીફ દૂર થાય છે.

સૂચનો

ગોઠણની વધુ તકલીફ હોય તેમને આ આસન ન કરવું.

સ્થિતિ - 1

દંડાસનની સ્થિતિમાં બેસવું.



સ્થિતિ - 2

બંને પગને ગોઠણાથી વાળી પગના પંજાની
ગાઈ બનાવી તેના પર બેસી જવું.
કરોડરજજુ સીધી રાખતા બંને હાથને
ગોઠણ પર મૂકો અને ગરદન સીધી રાખો.

મંડુકાસન

મંડુકનો સામાન્ય અર્થ દેડકો થાય છે.

આ આસનમાં સ્થિતિ દેડકા જેવી થતી હોવાથી આ આસનને 'મંડુકાસન' કહે છે.

ફાયદા

પાચનશક્તિમાં વધારો થાય છે.

ડાયાબિટીસમાં રાહત આપે છે.

જેને વારંવાર પેચોટી ખસી જતી હોય તેને માટે આ આસન ખૂબ લાભદાયક છે.

આ આસનથી શારીરમાં રક્તસંચાર બરાબર થવાથી દેહ નિરોગી રહે છે.

આ આસનથી એડીનું દર્દ મટે છે, આંખોની જ્યોતિ વધે છે, વીર્યની ઉધ્યુગતિ થવાથી શારીર વજ જેવું મજબૂત બને છે.

આ આસનથી નાભિમૂળમાં દબાણ આવવાથી કંદપીડન થાય છે,

જે કુંડલિની જાગ્રત કરવા માટે ઉપયોગી બને છે.

સૂચનો

કરોડરજજુની તકલીફ હોય તો આ આસન માર્ગદર્શકની સલાહમાં કરવું હિતાવહ છે.



स्थिति - 1

ंडासननी स्थितिमां बेसवुं.

स्थिति - 2

बंने पगने वाणो अने बंने पगना
तजीयानी गाढी बनावो.



स्थिति - 3

बंने हाथनी मुहुरी वाणो, श्वास छोडो, पेटने संपूर्ण खाली करो अने धीमे-धीमे शारीरने
कमरथी वाणी आगाजनी तरफ झूको, मों उपरनी तरफ राखी सीधी दृष्टि राखो.

ઉત્તાનપાદાસન

ઉત્તાનનો અર્થ ધાય છે (ઉપરની દિશા) અને પદ એટલે પગ, આ આસનમાં ઉત્તાન (ચિત્ત) પર સૂવાથી પગ ઉભા કરવામાં આવે છે, માટે આ આસનને 'ઉત્તાનપાદાસન' કહેવામાં આવે છે.

ફાયદા

પાચનશક્તિમાં વધારો કરે છે.

આ આસન નાભિ કેન્દ્ર (મણિપુર ચક)માં સંતુલન સ્થાપિત કરે છે.

પેટનો દુખાવો, વાયુ (પેટનો પવન), અપચો અને ઝડપ હૂર કરવામાં મદદગુરુપ છે.

પેટના સ્નાયુઓને મજબૂત બનાવી પેટની ચરબી ઓછી કરે છે.

સૂચનો

કમર દર્દ હોય તેવા બાળકોએ આ આસન નિષ્ણાતની સલાહ સાથે કરવું.
અથવા એક પગથી કરવું.



स्थिति - 1

जमीन पर सपाट सूतुं, पग सीधा राखो अने हाथ बाजुमां राखो.



स्थिति - 2

दृष्टाणा वाढ्या वगर श्वास लेवो, धीमे-धीमे तमारा बंने पग उपर
उंचा करो अने 30 डिग्रीनो झूळो बनावो. सामान्य रीते श्वास लो,
थोड़ीवार आ स्थितिमां रहो.

બાલમુકુંદાસન

બાળ એટલે બાળક અને મુકુંદ એટલે શ્રીકૃષ્ણ.

ફાયદા

પાચનશક્તિ સક્રિય બનાવે છે.

કરોડરજ્જુને સશક્ત બનાવે છે અને શારીરિક પીડાઓ દૂર કરે છે.

પગની માંસપેશીઓને વ્યાયામ મળે છે તથા પેટના વિકારો દૂર થાય છે.

સૂચના

કરોડરજ્જુની તકલીફ હોય તો માથું ઊંચું કરવું નહીં.

સ્થિતિ - 1

પીઠના બળો સીધા સૂઈ જાઓ.





स्थिति - 2

बूने पगना अंगूठा हाथथी पकडी
तेने नाक अथवा कपाणने स्पर्श
कराववानो प्रयत्न करो.



પવનમુક્તાસન

આ આસનના અભ્યાસથી વાયુ વિકાર તુરેંત દૂર થતો હોવાથી
આ સ્થિતિને 'પવનમુક્તાસન' કહે છે.

ફાયદા

કબજીયાતના રોગીઓ માટે વિશેષ લાભદાયક છે.

પેટના વિકારોને દૂર કરે છે.

ચહેરાનું તેજ વધારે છે.

વાળને ખરતા રોકે છે.

વાયુ સંબંધિત રોગ, ગઠીયા, સાંધાના હુખાવામાં રાહત આપે છે.

સ્થિતિ - 1

પીઠના બણો સીધા સૂઈ જાઓ.





સ્થિતિ - 2

બંને પગ છાતી સુધી લઈ જાઓ, બંને હાથથી બંને ઘૂંટણ પકડીને છાતી પર દબાવીને રાખો, શાસભરી શાસ છોડતા માથું ઉંચકીને નાક અને ઘૂંટણ પર સ્પર્શ કરો.



C. યાદશક્તિ / એકાગ્રતા વધારતા આસનો

બાલ્યાવસ્થા દરમિયાન અભ્યાસમાં યાદશક્તિ અને એકાગ્રતા ઉત્તમ રહે તે ખૂબ જરૂરી છે. યાદશક્તિ અને એકાગ્રતા જેટલી ઉત્તમ હશે તેટલું જ ભવિષ્ય ઉજ્જવળ બનશે. બાળકો મેધાવી અને તેજસ્વી બને તે માટે આપણી યોગ પરંપરામાં ધ્રુવાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન, ગરૂડાસન, પાદહસ્તાસન, શશાંકાસન, મત્સ્યાસન અને પદ્માસન જેવા આસનોની રૂચના કરવામાં આવી છે, આ આસનોના નિયમિત અભ્યાસથી યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

ધ્રુવાસન

ભક્ત ધ્રુવ દ્વારા આ આસન ધારણા કરી તપશ્ચયો કરી હોવાથી આ
આસનને 'ધ્રુવાસન' કહે છે.

ફાયદા

મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે.

વિધાર્થીઓમાં ચાદ્શાક્તિનો વિકાસ કરે છે અને આળસને દૂર રાખે છે.

પગને મજબૂત બનાવે છે.

સ્થિરતા પ્રદાન કરે છે.



स्थिति - 1

आसन पर सीधा उभा रहो.

स्थिति - 2

जमाणा पगने वाणीने डाबा पगना मूळ पासे
बहारनी तरइ राखो, बंने हाथने बाजुमां समांतर
राखो. समतोलन जाणवी पूरक करतां-करतां बंने
हाथ मस्तक पर ऊऱ्या करी नमस्कार मुद्रा करो.

વृक्षासन



'વृक्ष'નો અર્થ 'જાડ' થાય છે. આ આસન વृક્ષના આકારરૂપ હોવાથી તેને 'વृક્ષાસન' કહેવામાં આવે છે.

ફાયદા

એકાગ્રતામાં વધારો થાય છે.

પગ મજબૂત બને છે.

ખભા, ઘૂંઠી અને ઘૂંટણની સખતાઈ દૂર થાય છે.

થાક ઝડપથી દૂર થાય છે અને પગનો હુખાવો દૂર થાય છે.

માનસિક અને શારીરિક સ્થિરતા કેળવાય છે.

સૂચનો

મેદસ્ટ્વી બાળકે આ આસાન ન કરશું.

સ્થિતિ - 1

સીધા ઊભા રહો.



स्थिति - 2

જમણો પગ વાળીને તેનું
તળિયું ડાબા સાથળના
અંદરના ભાગ પર લગાવો
અને બંને બાજુથી હાથ
ઉપર તરફ લઈ જાઓ.

स्थिति - 3

સમતોલન જાળવી પૂરક કરતાં-કરતાં બંને હાથ
મસ્તક પર ઉંચા કરી નમસ્કાર મુદ્રા કરો.



ત्रिकोणासन

'त्रि'નો અર્થ 'ત્રણ' અને 'કોણ'નો અર્થ 'ભૂગ્રા' થાય. આ આસનમાં બે હાથ અને ધડ આ ત્રણ અંગો વડે ત્રિકોણ બનતો હોવાથી આ આસનને 'ત્રિકોણાસન' કહેવામાં આવે છે.

ફાયદા

એકાગ્રતામાં વધારો કરે છે.

પેટના સનાયુઓ મજબૂત બનવાથી પેટની તકલીફો દૂર થાય છે.

ગરદન, પીઠ અને પગના સનાયુઓ મજબૂત બને છે.

શરીર પર જામેલી વધારાની ચરબી દૂર થાય છે.

પીઠ અને પગનો દુખાવો મટે છે.

સૂચનો

કમરની મુશ્કેલી અથવા પેટનું કોઈ ઔપરેશન કરાવ્યાના તુરંત બાદ ડૉક્ટરની સલાહ વિના આ આસન ન કરવું.

પોતાની શારીરિક મર્યાદાને ધ્યાનમાં રાખીને આ આસન કરવું.



સ્થિતિ - 1

આસન પર બંને પગને ખલ્ખાની
સમાંતર રાખીને ઉભા રહો.



સ્થિતિ - 2

બંને હાથને બાજુની તરફ ઉપર
ખલ્ખાની સમાંતર રાખો ડાબા પગનો
પંજો ડાબી બાજુ સીધો કરો.

ત्रिकोणासन



स्थिति - 3

दीर्घ पूरक करी रेचक करतां-करतां कमरने डाबी बाजु झूकावो, डाबा हाथनी आंगजीओ डाबी एडी साथे लगावो. धूटण सीधा राखीने जमाणा हाथने आकाश तરफ सीधो करो, नजर आकाश तरफ करो.



स्थिति - 4

पूरक करतां करतां मूळ स्थितिमां पाणा आवो.



स्थिति - 5

आसन पर बने पगने छूटा राखीने उभा रहो त्यार बाट ए ज प्रमाणे जमाणी तरफ पाण पुनरावर्तन करो.

ગંડુડાસન



ફાયદા

એકાગ્રતામાં વધારો કરે છે.

પેશીઓને સુદ્રદ બનાવે છે.

ખભા, પગ અને હાથના સાંધાને લચીલા બનાવે છે.

સ્થિતિ - 1

દંડાસનમાં આરામથી ઉભા
રહી અને શાસોશ્વાસ
સામાન્ય રાખો. જમણા
પગને ડાબા પગ પર ટેકવો.
જમણી જંધ ડાબી જંધ પર
ટેકવેલી હોવી જોઈએ અને
જમણા પગની આંગળીઓને
જમીન પર રાખો.

સ્થિતિ - 2

હવે જમણા પગને ફેરવો
અને તેને ડાબા પગની
પાછળ એવી રીતે લાવો કે
જમણો પગનો અંગૂઠો
ડાબી પિંડી પર રહે. હવે
બંને હાથ ઉંચા કરો.



સ્થિતિ - 3

ડાબા હાથને જમાણા હાથ પર મૂકો, બંને
કોણીને 90° ડિગ્રી વાળો અને ડાબા હાથને
ફેરવી તેને જમાણા હાથની સામે લાવો,
બંને હથેળીઓ જોડો, કમાનુસાર સમસ્થિતિમાં
પાછા આવો અને બીજુ તરફ પુનરાવર્તન કરો.



પાદહસ્તાસન

‘પાદ’નો અર્થ ‘પગ’ અને ‘હસ્ત’નો અર્થ ‘હાથ’ થાય છે.
આમ ‘પાદહસ્તાસન’ ઓટલે કે જેમાં હાથને પગ તરફ નીચે લઈ જવા.

ફાયદા

એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે.

પેટ અને પેઢના તમામ અવયવોની કાર્યક્ષમતા વધે છે તથા તેને લગતી તકલીફો દૂર થાય છે.

કમર પાતળી બને છે અને કરોડરજજુ સ્થિતિસ્થાપક બને છે.

ખાસ કરીને કરોડની ચેતાઓ સતેજ બને છે અને પગ મજબૂત બને છે.

મૂત્રને લગતી તકલીફો અટકાવે છે.

સૂચનો

કમરના દુઃખાવા, પેટના આંતરિક સોજા, અલ્સર (ચાંદા), નેત્રરોગ,
ચક્કર, કરોડરજજુના દુઃખાવામાં આ આસન ન કરવું.



स्थिति - १

आसन पर बैठे
पगना पंजा भेगा।
राखीने सीधा उभा
रहो।



पादहस्तासन



स्थिति - 2

पूरक करतां-करतां बंने
हाथने मस्तक पर सीधा
उंचा करी थोड़ा
पाछળनी तरफ झूको.



स्थिति - 3

रेचक करतां-करतां कमरमांथी
आगण झूकी बंने हाथने
बंने पगनी बाजुमां मूँको.
पग धूटाजमांथी वजे नहीं
तेनी काणजु राखो.



स्थिति - 4

पूरक करतां, मूण
स्थितिमां पाछा आवो.

શશાંકસન

ફાયદા

બાળકોની મેધાવી શક્તિનો વિકાસ થાય છે.

માનસિક તરણાવ, કોધ, ચીડિયાપણું, ગુરુસો વગેરેને દૂર કરીને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

આંતરડાં, ચકૃત, સ્વાદુપિંડ અને કિડનીને ઉર્જા પ્રદાન કરે છે.

દમ અને હૃદયરોગીઓ માટે વિશેષ લાભપ્રદ છે.

સૂચનો

ધૂંટરણના દુખાવાવાળી વ્યક્તિએ સાવચેતી રાખવી
અથવા વજાસન ન કરવું.

સ્થિતિ - 1

વજાસનમાં બેસી જાઓ.



સ્થિતિ - 2

બંને હાથને શ્વાસ ભરતાં ઉપરની તરફ
ઉઠાવો, તે સમયે આગળની તરફ
વળતાં શ્વાસ બહાર છોડો, બંને પગ
આગળથી ખોલો.



સ્થિતિ - 3

બંને હાથને આગળની તરફ ફેલાવી. હુથેળીઓને નીચેની તરફ રાખતાં કોણી સુધી
હાથને જમીન પર ટેકવો, માથું અથવા દાઢી જમીન પર ટેકવો.

મત્સ્યાસન (ફિશ પોઝ)

મત્સ્યનો સામાન્ય અર્થ માછલી થાય છે, આ આસનમાં સ્થિતિ માછલી જેવી બનતી હોવાથી તેને 'મત્સ્યાસન' કહે છે.

ફાયદા

શીર્ષાસન અને સર્વાંગાસન પછી આ આસનને કરવાથી વિકારો દૂર થાય છે અને અગાઉ કરેલા યોગાભ્યાસના લાભમાં વધારો કરે છે.

બાળકોની એકાશ્રતા અને વિચારશક્તિમાં વધારો થાય છે.

સ્થિતિ - 1

પીઠના બળો સીધા સૂઈ જાઓ.





स्थिति - 2

हुवे बने पगने सूता-सूता पद्मासननी स्थितिमां आवो.



स्थिति - 3

बने हाथथी माथाना मध्यभागने जमीन पर टेकवो.

बने हाथथी बने पगना अंगूहा पकडो, कोणी जमीनथी अडाडीने
राखो अने पीठना भागने उपर उठावो.

પદ્માસન

ફાયદા

શરીર તથા મનમાં સ્થિરતા આવે છે.

નકારાત્મક વિચારો દૂર થાય છે.

અનિદ્રા દૂર કરે છે.

એકાગ્રતા, ચાદશક્તિ, તનાવ મુક્તિ, શાંતિ, માનસિક
શક્તિ વિગેરમાં વધારો કરે છે.

સ્થિતિ - 1

દંડાસનની સ્થિતિમાંથી બંને પગ ગોઠણથી
વાળી એકબીજાની જાંધ પર રાખવા,
કરોડરજજુ સીધી રાખવી.

સ્થિતિ - 2

બંને હાથ સીધા રાખ્યી હથેળીના પાછળના ભાગને
ગોઠણ પણ મુકવા. કરોડરજજુ સિવાય આખું
શરીર શિથિલ રાખવું.



06

મુદ્રા





ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ

(સરકારી, ધૂમા અને
સાર્વજ્ઞ પ્રદૂષિતાની નિયમ વિભાગ)



શાંભવી મુદ્રા

ફાયદા

ધ્યાન શક્તિનો વિકાસ થાય છે.

સ્મરાશશક્તિ તેજ બને છે અને
આજ્ઞાચક વિકસિત થાય છે.

આંખોમાં આકર્ષણ ઉત્પન્ન થાય છે અને
આંખોના તેજમાં પણ વૃદ્ધિ થાય છે.

સૂચનો

આંખોમાં દર્દ અનુભવાય અથવા
પાણી આવે તો તુરેત આંખો બંધ કરો.

રીત

સુખાસનમાં બેસો, કરોજરજજુ અને ગરદન ટવ્વાર રાખો.

હથમાં જ્ઞાન મુદ્રા બનાવવી, પૂર્ણ એકાગ્રચિત થઈ
દૃષ્ટિ બંને આંખોની વચ્ચે રાખવી.

ભૂમધ્યમાં દૃષ્ટિને સ્થિર કરવી, પલક ન ઝપકાવી જોઈએ.

એકીટસે ભૂમધ્યમાં દૃષ્ટિ સ્થાપિત કરવી, આંખમાં દર્દ થાય કે પાણી
આવે તો આંખ બંધ કરી 2 થી 3 વાર પુનરાવર્તન કરવું.



જ્ઞાન મુદ્રા

આ ખુબ જ પ્રચલિત મુદ્રા છે. જોવામાં સાધારણ
પરંતુ પ્રભાવમાં અત્યંત લાભદાયક મુદ્રા છે.

ફાયદા

નિરંતર અભ્યાસથી અનેક માનસિક બીમારીઓ દૂર થાય છે.

અનિદ્રા, ચીડિયાપારણ, કોધ, સ્મરણશક્તિમાં ઘટાડો જેવી અનેક
બીમારીઓમાં લાભદાયક છે.

સ્થિતિ

પદ્માસન, અર્દ્ધ પદ્માસન, સિદ્ધાસન અથવા સુખાસનમાં બેસો અને હાથોને ઘૂંઠારણ
પર મૂકી તર્જની આંગળીના આગળના ભાગથી અંગૂઠાના અગ્રભાગને સ્પર્શ કરો.
અન્ય આંગળીઓને સીધી રાખો. 15 મીનિટથી વધુ સમય શાંત મને બેસવું.



વિપરીત કરણી મુદ્રા

ધેરડ સંહિતા અનુસાર નાભિના મૂળમાં સૂર્ય નાડી અને મુખ પાસે ચંદ્ર નાડી આવેલી છે. જ્યારે નીચેથી સૂર્ય નાડી પોતાના તેજથી શરીરમાં રહેલા અમૃતનું પાન કરે છે ત્યારે મનુષ્યની મૃત્યુ થઈ જાય છે, સૂર્યને ઉપરની તરફ અને ચંદ્રને નીચેની તરફ લાવવાની હોય છે. એક બીજાની વિતરીત નાડીઓને લઈ જવાની હોવાથી આ મુદ્રાને વિપરીત કરણી કહે છે.

ફાયદા

નિત્ય અભ્યાસથી યુવાવસ્થા બની રહે છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે.

નિત્ય અભ્યાસથી જદુરાંગ્રી પ્રદિમ થાય છે.

ચકોનું ધ્યાન કરવાથી તેજ, બળ, વીર્યની વૃદ્ધિ થાય છે.

સ્થિતિ

સર્વાંગાસનની જેમ પગને ઉપર ઉઠાવીને શરીર તરફ પગ ઢાળેલા રાખો, યથાસંભવ 1 મીનિટ સ્થિર રહો.



07

પ્રાણાયામ



ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ

ગુજરાત, ગુજરાતને
સંકુળિક પ્રવાહનો વિકાસ કરો



ભસ્ત્રિકા

ફાયદા

હેહસાં મજબૂત બને છે, જેના કારણે દમ અને ક્ષય જેવા રોગો દૂર થાય છે.

શરદી, ખાંસી તથા વાયરલ ઇન્ફેક્શન દૂર કરે છે.

વાત, પિત, કહ જેવા દોષનો નાશ કરે છે.

શરીરના વિષેલા પદાર્થ દૂર થાય છે, જેથી રક્તનું શુદ્ધિકરણ થાય છે.

એલજીમાં ઝડપથી લાભ મળે છે.

સારી અને ગાઢ નિદ્રાનો અનુભવ થાય છે.

પાચનતંત્ર અને શ્વસનતંત્ર મજબૂત બને છે.

રીત

- » ધ્યાનાત્મક આસનમાં બેસવું.
- » બંને હાથમાં ધ્યાન મુદ્રા બનાવો.
- » બંને નાકથી પૂરી શક્તિ સાથે ઊંડો શ્વાસ ભરો અને ત્યારબાદ એટલી જ તીવ્રતાથી શ્વાસ બહાર છોડો.
- » ધીમી, મધ્યમ અને તીવ્ર ગતિથી અભ્યાસ કરી શકાય.



ક્રપાલભાતી



ફાયદા

આ પ્રાણયામ સમગ્ર શરીરનું કાયાકલ્ય કરે છે.

પાચનતંત્ર અને અંતઃસ્થાવી ગ્રંથિઓને કાર્યાન્વિત કરે છે.

બાળકોમાં હિમોગ્લોબિન, વિટામિન, મિનરલ્સની ઉણપ હોય તો
આ અભ્યાસ લાભદાયક છે.

શરીરમાં કોઈ બ્લોકેજ હોય, કોઈ પણ સ્થાનમાં ટ્યૂમર હોય તો
આ પ્રાણયામનો અભ્યાસ લાભકારક છે.

ડાયબીટિસ કે વાયુ સંબંધિત વિકારો દૂર કરે છે.

ચહેરાના તેજમાં વધારો કરે છે.

વજન ઓછું કરવા લાભદાયક છે.

સૂચનો

બાળકોમાં વધુ ચંચળતા હોય તો કપાલભાતી પ્રાણયામનો વધુ ઝડપી અભ્યાસ કરવો.

રીત

સક્રિયતાપૂર્વક શ્વાસ છોડવો અને નિષ્ક્રિયતાથી શ્વાસ ભરવા પર ધ્યાન આપવું.

એક સેકન્ડમાં એકવાર શ્વાસ બહાર છોડવો.

શ્વાસ બહાર છોડો ત્યારે પેટ અંદરની તરફ લઇ જવું.

શ્વાસ તીવ્રતાથી બહાર કાઢવો.

શરૂઆતમાં 30-30નો રાઉન્ડ કરવો, ધીરે-ધીરે શરીરની ક્ષમતામાં વધારો થાય તે
રીતે અભ્યાસમાં વધારો કરવો.

આ પ્રાણયામનો 5 મીનિટ નિયમિત અભ્યાસ કરવો.

અનુલોમ વિલોમ



સમય (અનુપાત)

શરૂઆતમાં શ્વાસ ભરવાની, રોકવા અને છોડવાનો સમય સરખો રાખવો. (1:1:1)

અભ્યાસ અને ક્ષમતામાં વધારો થાય તે રીતે અનુપાતમાં વધારો કરો. (1:2:1)

સારો અભ્યાસ થાય પછી (1:4:2)ના સમયથી શ્વાસોશ્વાસની કિયા કરવી.

શ્વસન

શ્વસન ધીમું અને મંદ હોવું જોઈએ.

એક લયથી શ્વાસ લેવો અને છોડવો.

શ્વાસ લેતા અને છોડતા શ્વસનો અવાજ ન આવવો જોઈએ.

શાયદા

અનુલોમ વિલોમ પ્રાણાચામથી શાંતિનો અનુભવ થાય છે તથા એકાગ્રતામાં વધારો કરે છે.

તાણાવ દૂર કરી જીવન શક્તિમાં વધારો કરે છે.

દુર્બળથી દુર્બળ વ્યક્તિ પણ સ્વસ્થ બને છે.

રીત

સૌપ્રથમ કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસો.

કરોડરજ્જુ, ગરદન સીધી અને આંખો બંધ રાખો.

જમણા હાથથી પ્રાણવમુદ્રા બનાવો. ડાબા હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી ઠીંયણ પર રાખો.

સૌપ્રથમ જમણા અંગૂહાથી જમણી નાસિકાને બંધ કરો અને ડાબા નાસિકાથી ધીમે-ધીમે શાસ ભરો.

બંને નાસિકા બંધ કરો, ધીરે-ધીરે જમણી નાસિકાથી શાસ બહાર કાઢો પછી તુરત જ જમણી બાજુથી શાસ ભરો, ડાબી નાસિકા બંધ રાખો.

જમણી નાસિકા બંધ કરો અને ડાબી બાજુથી શાસ બહાર કાઢો, આમ એક રાઉન્ડ થયો.

આ પ્રમાણેનો 5 થી 10 મીનિટ અભ્યાસ કરો.



ભામરી



ફાયદા

એકાગ્રતા વધારવા માટે અત્યંત લાભદાયક છે.

તણાવ, કોધ, ચિંતા અને અનિદ્રા દૂર કરે છે.

મન શાંત કરી અંતર્મુખી બનાવે છે.

તંત્રિકા તંત્ર પર ખૂબ સારી અસર પડે છે.

ધ્યાનમાં સરળતાથી પહોંચવા માટે ખૂબ લાભદાયી છે.

સૂચનો

કાનના ગંભીર રોગો હોય તેમણે આ પ્રાણાયામનો અભ્યાસ
નિરક્ષકની ઉપસ્થિતિમાં કરવો.

રીત

આંખો બંધ રાખી કુમર ગરદન સીધી રાખી ધ્યાનાત્મક આસનમાં બેસવું.

બંને હાથો વડે સનમુખી મુદ્રા બનાવવી અંગૂઠાથી કાન બંધ કરો, પ્રથમ આંગળી (તજ્જની)ને
ભ્રમર પર રાખો, બીજુ આંગળી (મધ્યમા)ને કોમળતાથી આંખો પર રાખો.

ત્રીજુ આંગળી (અનામિકા)ને નાકના હાડકા જેવા ભાગ પર રાખો.

ચોથી આંગળી (કનિષ્ઠા)ને નાક અને હોઠની વચ્ચેના ભાગ પર રાખવી.

ત્યારબાદ શ્વાસ શ્વાસ ભરી શ્વાસ છોડતા દીર્ઘ સ્વરોમાં મકારની ધ્વનિનું ઉચ્ચારણ કરો.

ભ્રમરો જેવી રીતે ગુજ્જન કરે તેવી રીતે મકારની ધ્વનિનો નાદ કરો.

શીતલી

શીતલી એટલે હડક. આ પ્રાણાયામનો અભ્યાસ મન અને શરીરને હડક પ્રદાન કરે છે.

રીત

- » પદ્માસન અથવા સુખાસનમાં બેસો.
- » બંને હથ ધૂંટણ પર રાખો, કરોડરજજુ ટઢ્ઠાર રાખો.
- » જુભને બાજુઓથી એક કરી નળીનો આકાર આપો.
- » નળી આકાર થયેલી જુભ દ્વારા શ્વાસ લો; ફેફસાંને તેમની મહત્તમ ક્ષમતા સુધી હવાથી ભરો; જુભને મૌંની અંદર લો અને મૌં બંધ કરો.
- » નાક દ્વારા ધીમે-ધીમે શ્વાસ છોડો.
- » 5 થી 10 મીનિટ તેને પુનરાવર્તિત કરો.

ફાયદા

- » આ પ્રાણાયામથી મન પ્રસત્ત અને પિત દોષ દૂર થાય છે.
- » તરસમાં ઘટાડો કરે છે.
- » રક્ત શુદ્ધિ કરે છે અને મન શાંત થાય છે.

ઉદ્ગીત પ્રાર્થાયામ



ફાયદા

- » માનસિક વિકારો દૂર થાય છે.
- » મન શાંત અને સ્થિર થાય છે.
- » અનિદ્રા અને દુઃસ્વપ્તમાંથી છૂટકારો મળે છે.
- » ચહેરાનું તેજ વધે છે.
- » નકારાત્મકતા દૂર થાય છે.



રીત

- » કોઈ પાણી ધ્યાનાત્મક આસનમાં નેત્રો બંધ કરી બેસવું.
- » ઉંડા, શ્વાસ ભરી શ્વાસ છોડતા-છોડતા ઓમકારની ધ્વનિનું ઉચ્ચારણ કરવું.

08

ત્રાટક

ફાયદા

- » ત્રાટકથી આંખોનું તેજ વધે છે.
- » આંતરિક શાંતિ મળે છે, જેથી તણાવમાં રાહત મળે છે.
- » મગજને આરામ આપે છે.
- » એકાશતામાં વધારો થાય છે.
- » વિચારો ઓછા થાય છે, જેથી મગજને આરામ મળે છે.

રીત

- » આરામદાયક સ્થિતિમાં બેસો, હાથને ધ્યાન મુદ્રા બનાવી ઠીંચાણ પર રાખો.
- » હવે ધીમા શ્વાસ લઈ આંખો બંધ કરી થોડા સમય માટે બેસો.
- » ત્યારબાદ આંખો ખોલી અને દૃષ્ટિ સ્થિર કરી મીણબંધની જ્યોત પર આંખો પટપટાવ્યા વગર એકીટસે જૂઓ.
- » આંખોમાંથી પાણી આવે અથવા આંખમાં પીડા થાય તો આંખ બંધ કરી દેવી.
- » 3 થી 5 વાર પુનરાવર્તન કરવું.

સૂચનો

ત્રાટક કિયાને મીણબંધની અથવા અન્ય કોઈ વસ્તુ રાખીને પણ કરી શકાય છે, જેમ કે નાકની આગળનો ભાગ અથવા ઇષ્ટદેવની પ્રતિમા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.



09

ધ્યાન

સૂચનો

ધ્યાનના પ્રારંભિક તબક્કામાં મનને પ્રસત્ર કરે તેવું સંગીત વગાડી શકાય.

જેટલો સમય બેસી શકાય તેટલો સમય આ સ્થિતિમાં બેસવું.

રીત

- » કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસો.
- » કરોડરજ્જુને આરામથી એકદમ સીધી રાખો.
- » ધ્યાનમુદ્રા અથવા જ્ઞાનમુદ્રા ધારણ કરો.
- » માથાને સીધું રાખીને આંખો કોમળતાથી બંધ કરીને બેસો.
- » તમારી ભ્રમરોની વચ્ચે હળવું ધ્યાન લઈ જાઓ અને આવતા-જતાં શ્વાસનો અનુભવ કરો.
- » પૂર્વ વિચારોને છોડવાનો પ્રયાસ કરો અને પવિત્ર નિર્મળ વિચાર મનમાં લાવવાનો પ્રયાસ કરો.
- » નિર્મળ વિચારો સાથે સાથે આ સ્થિતિમાં થોડો સમય સ્થિર રહો.



10

આદર્શ
બાળક



ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ
ગુજરાત સરકાર
અધ્યક્ષદ્વારા પ્રયોગિક વિજ્ઞાન અક્ષામ



આદર્શ બાળકની દિનચર્ચા

દરરોજ સવારે સૂર્યોદય પહેલા જાગવું.

નિયમિત યોગાભ્યાસ તથા સૂર્યનમસ્કાર.

નિયમિત પ્રાર્થના કરવી.

નિયમિત શાળાએ જવું.

હુંમેશા એકાગ્રતા, અને ખંતથી અભ્યાસ કરવો.

નિયમિત રીતે સંતુલિત અને ધરનો જ આહાર લેવો.

ઓછામાં ઓછી એક કલાક ધરની બહાર કોઈ રમત રમવી.

સૂતા પહેલા પ્રેરક પુસ્તક વાંચવું.

રાત્રે સમયસર સૂઈ જવું.

આદર્શ બાળકનો આહાર

હાડકાંની મજબૂતી માટે નિયમિત દૂધ પીવું.

સવારે ઘરના નાસ્તા સાથે અવશ્ય કોઈ એક ફળ લેવું.

શોજિંદા ભોજનમાં કઠોળ, લીલાશાકભાજુનું પ્રમાણ વધુ રાખવું.

ગમા-આણગમા છોડી દરેક પ્રકારના ભોજનની આદત પાડવી.

ક્યારેય અન્નનો અનાદર ન કરવો.

પૂરતા પ્રમાણમાં પાણી પીવું.

આઇસક્રીમ, ચોકલેટ, ફાસ્ટફૂડ અને પેંક ફૂડને ટાળો.

ખુલ્લો અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ક્યારેય ન ખાવો.

દરેક ભોજન પહેલા ભગવાનનું સ્મરણ કરવું.

સૂર્યાસ્ત પહેલા રાત્રીનું ભોજન કરવાની આદત પાડો.

રાત્રીના ભોજન માટે હળવું ભોજન પસંદ કરો.

આદર્શ બાળકના સંસ્કાર

દરરોજ માતા, પિતા, વડીલ, ગુરુજનો અને શિક્ષકોને પગે લાગવું.

વડીલોની દરેક આજાનું પાલન કરવું.

મહિનાની પ્રાર્થના સાથે દિવસની શક્તિઓ કરવી.

દરરોજ ઓછામાં ઓછી 30 મીનિટ સારા પુસ્તકોનું વાંચન કરવું.

આચ્છાદનભદ્ર અને એકાગ્રતાથી અભ્યાસ કરવો.

વ્યસનોથી દૂર રહેવું અને બીજાને પણ પ્રેરણ આપવી.

નિયમિત મંદિર/દિવસ્થાને જવું.

શારીરિક સાથે માનસિક શ્રમ થાય તેવી રમતો રમવી.

પોતાનું દરેક કામ જાતે જ કરવું.

પર્યાવરણનું જતન કરવું.

દેશના નિયમોનું પાલન કરવું.

મોબાઇલની આડઅસરો

મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે મગજ પર ગંભીર
અસર થઈ શકે છે.

મોબાઇલના રેડિયો તરંગો માત્ર કાનની આસપાસ જ નહીં,
પરંતુ મગજ પર પાણ ઊંડી અસર કરે છે.

મોબાઇલના કારણે શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થઈ શકે છે.

મોબાઇલની આદતના કારણે એકાચ્રતા તથા નવું શીખવાની
ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે.

ઓછા પ્રકાશમાં મોબાઇલ જોવાને કારણે આંખોમાં
સમસ્યા થઈ શકે છે.

મેલાટોનિન સ્નાવને કારણે આપણને ઊંઘ આવે છે, પરંતુ
મોબાઇલની બ્લૂ લાઇટને કારણે મગજમાં મેલાટોનિન સ્નાવ
ઉત્પત્ત ન થવાને કારણે ઊંઘમાં ઘટાડો થઈ શકે છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ



Gujaratyogboard



Gujaratyogboard



@Gujaratyogboard



@Gujaratyogboard



ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

બ્લોક-19, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10એ, ગાંધીનગર - 382010

📞 079 232 58342/43 🌐 www.gsyb.in